



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૯/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૭૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૦ કેસ કરી, ૭૫ વ્યક્તિઓને ઝડપી, ૧૭૨ લીટર દેશી દારૂ, ૧૭ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૯૫ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૬ કેસ કરી ૩૮ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭૬,૧૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૭૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૬૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૧૪૭૪/૧૯

શાહપુર: મહમદ ઓવેશ સ/ઓ મોઇનુદ્દીન શેખ (રહે.ડોડીયાવાડ મસ્જીદની ગલીમા શાહપુર અહા શાહપુર) એ તા.૦૧/૦૯/૧૯ નારોજ શાહપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૦૮/૧૯ બપોરના ૧/૪૫ થી ૨/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના મકાનનો દરવાજો ખોલી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી મોબાઇલ ફોન, સોનાનું બ્રેસલેટ અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૪૧,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ઓ.તિવરી ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૪૭૫/૧૯

બાપુનગર: પ્રિયાબહેન વા/ઓ રાજાભાઈ મુદલીયાર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ ગાયત્રી મંદિર પાછળ બાપુનગર) એ તા.૦૧/૦૯/૧૯ નારોજ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૮/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે બાપુનગર ગાયત્રી મંદિર સામેથી અજાણી મીલ સર્કલ કોમ્પ્લેક્સ વિજયસેલ્સ ઈન્ડિયા સુધીની શટલ ઓટોરિક્ષાની મુસાફરી દરમ્યાન રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ એક સ્ત્રી અને બે પુરૂષોએ પ્રિયાબહેનની નજર ચુકવી પ્રિયાબહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર પેડલ સાથે કિંમત રૂપિયા ૧,૯૨,૫૦૦/- ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.ગઢવી ચલાવે છે.

મણીનગર: વિનોદભાઈ લક્ષ્મણદાસ સંગતાણી (રહે.ન્યુ ગુડલક સોસાયટી દક્ષીણી સોસાયટી મણીનગર) એ તા.૦૧/૦૯/૧૯ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૮/૧૯ સાજના ૫/૩૦ થી ૫/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના ખુલ્લા ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રૂપિયા ૧૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૦૦,૯૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન.પરમાર ચલાવે છે.

પહેલા માળેથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૪૭૬/૧૯

ખોખરા: ગીરીશભાઈ સુરેશભાઈ બરમન (ઉ.વ.૪૨) (રહે. રામજીભાઈની ચાલી રાધાકિશન સોસાયટી હાટકેશ્વર ખોખરા) તા.૦૧/૦૯/૧૯ સવારના ૯/૩૦ વાગ્યાના સુમારે હાટકેશ્વર ભાવનાનગર ખાતે કડીયાકામ કરતા હતા ત્યારે પાલખ તુટી જતા પહેલા માળેથી નીચે પડતા ગંભીર ઈજા થતા સારવાર માટે સીવીલ હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન બપોરના ૨/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૪૭૭/૧૯

વટવા: લક્ષ્મીબહેન ઉર્ફે નયના ડો/ઓ ગણેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.૧૬) (રહે. શિવપાર્ક સોસાયટી પુનિતનગર ઘોડાસર વટવા) એ અગમ્ય કારણસર તા.૦૧/૦૯/૧૯ બપોરના ૧/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતના હુકમાં દુપટ્ટે બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.એમ.દેસાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.